

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૦૧/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૧ કેસ કરી, ૨૦ વ્યક્તિઓને ઝડપી, ૫૫ લીટર દેશી દારૂ, ૧૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૦૧ એક્ટીવા કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી ૨૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૫,૭૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૯/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૧૫૦/૧૭

કૃષ્ણનગર : મંગળભાઈ કાળીદાસ ચૌહાણ (ઉ.વ.૬૭)(રહે,હીરાવાડી સોસાયટી, માણસા જી.ગાંધીનગર) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૧૨/૧૪ થી તા.૨/૨/૧૬ બપોરના ૧/૩૦ વાગ્યા દરમિયાન આરોપી (૧)દશરથભાઈ કાળીદાસ ચૌહાણ (૨) ચેતનાબેન વા/ઓફ દશરથભાઈ કાળીદાસ ચૌહાણ (૩) ઇલેશ દશરથભાઈ ચૌહાણ (ત્રણેય રહે,હરીધામ સોસાયટી બાપા સીતારામ ચોક, કૃષ્ણનગર) ભેગામળી મંગળભાઈને વિશ્વાસમાં લઈ સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૪૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૫૩,૦૦૦/- ની મતા મેળવી લઈ, મંગળભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એ.રાહોડ ચલાવે છે.

બળજબરીથી રોકડ કઢાવી લીધી :-

સમાચાર યાદી નં.૧૫૧/૧૭

નિકોલ : મનીશકુમાર કાનજીભાઈ પટેલ (રહે, સમય બંગ્લોઝ, નિકોલ ગામ) એ તા.૨૧/૧/૧૭ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૦૭ થી તા.૩૧/૮/૨૦૧૬ સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) કિરીટભાઈ મનજીભાઈ વિરડીયા (૨) રાજેશભાઈ મનજીભાઈ વિરડીયા (બંને રહે, અમીકુંજ સોસાયટી ઠક્કરનગર નરોડા) (૩) નીખીલ (૪) રાહુલ (જે બંનેનાં પુરા નામની ખબર નથી (બંને રહે,વૈશાલી ફ્લેટ બાપુનગર) (૫) લાલજીભાઈ અકબરી (રહે,વિરાટનગર વેરા પાસે નિકોલ) એ ભેગામળી “મનીશકુમારનાં નાના ભાઈ સતીષભાઈ નાઓ જુગારમાં હારી ગયેલ છે” તેમ જણાવી મનીશભાઈ ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તેમની પાસેથી કુલ રૂપિયા ૨૨,૦૦,૦૦૦/- બળજબરીથી કઢાવી લીધા હતા. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી સી.બી.ગામીત ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૫૨/૧૭

ચાંદખેડા : અનિલકુમાર રામકૃષ્ણ પિલ્લઈ (રહે,શિવમ બંડ્લોઝ દેવકુટીર બંડ્લોઝની સામે, ન્યુ સી.જી રોડ ચાંદખેડા) એ તા.૨૧/૧/૧૭ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૧૧/૧૬ બપોરનાં ૩/૦૦ વાગ્યાનાં સુમારે પોતાનાં ઘરે પોતાની દિકરીને બે અજાણ્યા પુરુષે જણાવેલ કે “આ મકાનમાં વોલપેપરનું કામ અમોએ કરેલ છે અને તેના ફોટા બીજા ગ્રાહકને બતાવવા સાડ ફોટા પાડવા છે” તેમ કહી અનિલકુમારનાં ઘરમાં ઉપરના માળે પ્રવેશ કરી, કબાટના ડ્રોઅરમાં મુકેલ સોનાના નેકલેસ સેટ કુલ કિંમત રૂપિયા ૧,૨૫,૦૦૦/- મતાનાં ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.બી.ચાવડા ચલાવે છે.

પાણીની ટાંકીમાં પડી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૫૩/૧૭

વટવા : પાયલ ડો/ઓ ગુકુદાસ દાસ (ઉ.વ.૦૨)(રહે,સાંઈબાબા એપાર્ટમેન્ટ, જયમીન પાર્ક સોસાયટીની બાજુમાં વટવા) તા.૨૧/૧/૧૭ બપોરનાં ૨/૧૦ વાગ્યાના સુમારે તેમના પાડોશનાં બ્લોકમાં રહેતા સબંધીને ત્યાં રમવા માટે ગયેલ હતી. જ્યાં રમતા-રમતા બ્લોકની નીચે આવેલ પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં, સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લાવતાં ફરજ પરના ડો.શ્રી એ પાયલને મૃત જાહેર કરી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.સી.ઝાલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૫૪/૧૭

શહેરકોટડા : શીવપાલ કલ્લુભાઈ કોળી (ઉ.વ.૩૮)(રહે,બાલ્મણની ચાલી અનીલ સ્ટાર્ચ મીલ રોડ)એ કોઈ અગમ્ય કારણસર તા.૨૦/૧/૧૭ રાતનાં ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે કેરોસીન છાંટી સળગી જતાં, શરીરે ગંભીર રીતે દાઝી જતાં શીવપાલનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વાલસિંગભાઈ મલાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.